SHASHIJIT INFRAPROJECTS LIMITED

Construction Engineers ISO 9001:2015 Certified



Wednesday, 15th February, 2023

T: +912602432963, 7878660609

CIN: L45201GJ2007PLC052114

E: info@shashijitinfraprojects.com

W: www.shashijitinfraprojects.com

To, BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai-400001

Scrip Code : 540147
Security ID : SHASHIJIT

Sub: Newspapers clippings – Submission of Standalone Un-audited Financial Results for the quarter and nine months ended on 31st December, 2022

Ref : Regulation 47(1)(b) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Pursuant to Regulation 47(1)(b) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copy of Newspaper Advertisement submitting Standalone Un-audited Financial Results for the quarter and nine months ended on 31st December, 2022.

The Advertisement published in "DAMAN GANGA TIMES" (Gujarati Newspaper) and in "FREE PRESS JOURNAL" (English Newspaper) dated 15th February, 2023.

We request you to take the above on record and disseminate the same on your website.

Yours faithfully,

For SHASHIJIT INFRAPROJECTS LIMITED

MANTHAN
DINESHKUMAR SHAH
Date: 2023.02.15 12:22:41 +05'30'

(MANTHAN D. SHAH)
Company Secretary & Compliance Officer

Encl. as above

DICKINSON FOWLER PRIVATE LIMITED

Regd. Office: Raj Mahal Building, 4th Floor, 84

Veer Nariman Road, Mumbai - 400 024. Notice is hereby given that the Certificate(s) for the under mentioned Equity Shares of the Company have been lost / misplaced and the holder of the said Equity Shares have applied to the Company to issue duplicate Share Certificates. Any person who has a claim in respect of the said Shares should lodge the same with the Company at its Registered Office within 15 days from this date else the Company will proceed to issue duplicate certificates to the aforesaid applicants without any further intimation.

Name of the Share holder	Folio No.	Share Certificate	Distinc	No of shares		
Citaro ilotadi		No	From	То	ona.co	
Korber	004	003	3	610002	6,10,000	
Technologies	004	006	1640001	2060000	4,20,000	
Limited	004	009	2730001	3400000	6,70,000	
(Formerly known as	004	011	3675001	3950000	2,75,000	
Garbuio	004	013	4078951	4207900	1,28,950	
Limited and	004	017	4403951	4600000	1,96,050	
Dickinson Legg Limited)		Total			23,00,000	

On behalf of the Board of Directors of Dickinson Fowler Private Limited

Mumbai February 09, 2023 K B Vijayakumar

CAPROLACTAM CHEMICALS LIMITED

(CIN: L24110MH1988PLC049683) Regd. Office: B/31, MIDC, Mahad, Dist. Raigad - 402302 Extract of Standalone unaudited Financial Results for the Quarter Ended 31st December, 2022

Particulars	Qut. Ended	Qut. Ended	Year Ended
r di licular s	31.12.2022 Un Audited	31.12.2021 Un Audited	31.03.2022 Audited
Total Income from Operations (net)	237.32	17.81	247.44
Net Profit / (Loss) from ordinary activities after Tax Net Profit / (Loss) for the Period after Tax	62.16	(75.99)	(147.40)
(after Extra Ordinary Items)	73.51	(80.96)	(128.21)
Equity Share Capital		(00.00)	(,
(Face Value Rs. 10/- per share)	460.00	460.00	460.00
Reserves (excluding Revaluation Reserves as shown in the Balancesheet of Previous Year) * Earnings Per Share (before and after extra	-	=	(180.20)
Ordinary items) (of 10/- each)			
Basic #	1.60	(1.76)	(2.79)
Diluted #	1.60	(1.76)	(2.79)
Note -			

The above is an extract of the detailed format of Quarterly unaudited & yearly audite Financial Results Filed with the Stock Excanngeunder Regulation 33 of the SEB (Listing Obiligations and Disclosure Requirements) Regulations 2015. The full format o the Quarterly Unaudited Financial Results are available on www.bseindia.com and or the Company website www.caprolactam.co.in

. The above Unaudited Financial Results were reviewed by the Audit Committee a approved by the Board of Directors at the meeting held on February 14, 2023. The Statutory Auditors have carried out Limited Review of the above Financial Results.

Place : Mahad Z S Bhanusha (Managing Director)(DIN NO. 00663374) Dated: February 14, 2023

SPENTA INTERNATIONAL LIMITED CIN No: L28129MH1986PLC040482

Tel No. 7666625388/7666025388, Website: www.spentasocks.com	
UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER	(Rs. In Lakhs)

	AND NINE MONTH ENDER	31-12-20	22	(,	
SI. No.	Particulars	Quarter ended 31-12-2022	Nine Month ended 31-12-2022	ended	Year ended 31.03.2022
		Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	1102.84	4229.60	1368.70	5123.08
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-33.23	40.4	35.03	265.48
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items.)	-33.23	40.4	35.03	265.48
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-30.67	31.94	31.16	218.99
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-31.27	30.14	30.17	225.84
6	Equity Share Capital	276.43	276.43	276.43	276.43
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				2385.51
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	_	_		
	(a) Basic	-1.11	1.16	1.13	7.92
	(b) Diluted	-1.11	1.16	1.13	7.92

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the QuarterlyFinancial Results are available on the websites of the Stock Exchange at www.bseindia.com (s) and the Company's we For Spenta International Limited

Mr. Danny Hansotia Managing Director & CFO Date: 14.02.2023 Place: Palghar

> **GARBI FINVEST LIMITED** CIN: L65100MH1982PLC295894
> Regd. Offc: F-114, 1st Floor, Nahar and Seth Ind.Estate, Chakala Road, Near P and G Plaza, Andheri East, Mumbai-400099 Email: garbifinvest@gmail.com; website: www.gptl.in

Statement of Unaudited Financial Results for the quarter and 9 months ended 31st December, 2022 (Rs. In lace								
		Quarter End	ed	Nine Mon	ths Ended	Year Ended		
Particulars	Dec 31, 2022 (Unaudited)	Sep 30, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Dec 31, 2022 (Unaudited)	Dec 31, 2021 (Unaudited)	Mar 31, 2022 (Audited)		
Revenue from Operations	(Ollaudited)	(Ollaudilleu)	(Orlandited)	(oriaudited)	(Ollaudiled)	(Audited)		
(a) Revenue from Operations	77.69	125.24	955.72	258.85	1.879.52	3652.81		
(b) Other Income		_	-			-		
Total income from operations (Net)	77.69	125.24	955.72	258.85	1,879.52	3.652.81		
Expenses					,,,,,,,,,	,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,		
(a) Employee benefits expense	14.18	15.51	12.34	43.30	25.33	54.15		
(b) Depreciation and amortisation					10.000.000.000			
expenses		-	0.13		0.26	0.55		
(c) Finance Cost		-	-					
(d) Other expenses	5.03	5.70	7.79	18.23	18.65	57.81		
(e) Impairment loss on financial								
instruments		-				417.72		
Total Expenses	19.21	21.21	20.26	61.53	44.24	530.24		
Profit/ (Loss) before exceptional								
and Tax (1-3)	58.48	104.03	935.46	197.33	1,835.28	3,122.57		
Exceptional Items		-	-					
Profit/ (Loss) before Tax (4-5)	58.48	104.03	935.46	197.33	1,835.28	3,122.57		
Tax expense								
- Current Tax	15.35	15.81	21.51	31.17	25.26	43.86		
- Deferred Tax (Asset) / Liability	10.81	10.81	212.35	32.42	424.70	111.17		
Profit/(loss) from for the period								
(after tax) (6 - 7)	32.32	77.41	701.60	133.74	1,385.32	2,967.54		
Total Comprehensive Income for								
the period Comprising Profit/								
(Loss) and (Other comprehensive								
Income for the period)	32.32	77.41	701.60	133.74	1,385.32	2,967.54		
Earning per share (of Rs. 10/- each)								
(for continuing operations)								
- Basic	0.28	0.66	5.98		11.81	25.30		
- Diluted	0.28	0.66	5.98		11.81	25.30		
Paid- up equity share capital	1,173.07	1,173.07	1,173.07		1173.07	1173.07		
(Face Value- Rs. 10/-)								
Reserve excluding revaluation								
Reserves as per Balance						5659.27		
Sheet of previous accounting year								
Notes:								

Notes:

- 1 The above Results were approved by Audit Committee at its meeting held on 14/02/2023 and taken on record by Board of Directors at its meeting held on 14/02/2023. The above financial results were also reviewed by the Statutory Auditors.
- ? The Company operates predominantly only in one sector i.e. Non-Banking Financia Activities, therefore there are no reportable segments as per Ind AS 108.
- This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
- Corresponding previous year/ period figures have been rearranged/ regrouped

For Garbi Finvest Ltd. Sd/- Rupesh Kumar Pandey Managing Directo Place : Mumbai (DIN: 00150561 Date: 14.02.2023

THE HINDUSTAN HOUSING COMPANY LIMITED bajaj group

Regd. Office: Bajaj Bhavan, 2nd Floor, Jamnalal Bajaj Marg, 226, Nariman Point, Mumbai - 400 021. Telephone: 2202 3626 / 2282 0943

CIN: L45200MH1934PLC002346 Website: hhclbajaj.com EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2022

Sr. No.	Particulars	Quarter Ended	Nine Months Ended	Quarter Ended
		31.12.2022	31.12.2022	31.12.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations (net)	170.23	517.03	158.22
2	Net Profit/(Loss) for the period before tax,	53.22	186.31	53.72
	Exceptional and/or Extraordinary items)			
3	Net Profit/(Loss) for the period after tax,	42.87	146.57	40.8
	Exceptional and/or Extraordinary items)			
4	Total Comprehensive Income for the period	(135.93)	132.14	(62.40
	(Comprising of Profit/(Loss) for the period (after tax) and			
	Other Comprehensive Income (after tax)			
5	Equity Share Capital	6.09	6.09	6.0
6	Basic and Diluted Earnings Per Share (in ₹)	177.15	605.66	168.7
	(before and after extraordinary items) (Face value of ₹25/- each)			

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with BSE Ltd. under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Year ended Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.hhclbajaj.com.

By Order of the Board of Directors

For The Hindustan Housing Co. Ltd.

Vinod Nevatia

Chairman

Mumbai: 14th February, 2023

ENVAIR ELECTRODYNE LTD. ヒロyaır Regd. Office: 117, S Block, MIDC, Bhosari, Pune- 411026. ☎: 020-30688117/18 CIN: L29307MH1981PLC023810

	Extract of the Un-audited Financial Results for the Quarter / Nine Months ended 31/12/2022 Rs. in Lakhs (Except figures of EPS)									
Sr.		C	Quarter Ended			ths ended	Year ended			
No.	l Particulars	31/12/2022	30/09/2022	31/12/2021	31/12/2022	31/12/2021	31/03/2022			
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)			
1	Total Income from operations (net)	91.46	10.36	3.11	101.20	10.09	486.00			
	Net Profit / (Loss) for the period (before Tax,									
	Exceptional and/or Extraordinary items#)	37.74	(52.91)	(8.45)	(84.40)	(22.10)	(77.04)			
3	Net Profit / (Loss) for the period before tax									
	(after Exceptional and/or Extraordinary		000 54	(0.45)	4 040 05	(00.40)	(77.04)			
	items#)	37.74	980.51	(8.45)	1,018.25	(22.10)	(77.04)			
	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary									
	(taiter Exceptional and/or Extraordinary	37.74	757.50	(8.45)	795.24	(22.10)	(77.04)			
5	Prior period items	37.74	131.30	(0.43)	133.24	(22.10)	(11.04)			
_	Total Comprehensive Income for the period									
•	[Comprising Profit / (Loss) for the period									
	(after tax) and Other Comprehensive Income									
	(after tax)]	37.74	757.50	(8.45)	795.24	(22.10)	(77.04)			
7	Equity Share Capital	464.00	464.00	464.00	464.00	464.00	464.00			
8	Reserve (excluding revaluation reserve as									
	shown in the Balance Sheet of Previous Year)	==	-	-	-	-	-			
9	Earning Per Share (Face Value of Rs.5/- each)									
	(Not to be annualized)	202	12 22				27.72			
	1. Basic:	0.81	(0.16)	(0.27)	17.14	(0.70)	(1.67)			
	2. Diluted :	0.81	(0.16)	(0.27)	17.14	(0.70)	(1.67)			

Notes-

1.The above results have been reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at the neeting held on February 14, 2023.

?. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website and or Company's website (www.envair.in) on Behalf of Board of Directors

Place: Pune Date: 14th February 2023

For Envair Electrodyne Limited (Director)

SHASHIJIT INFRAPROJECTS LIMITED

CIN: L45201GJ2007PLC052114 Registered Office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Girnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India

Tel. No. 0260-2432963 W: www.shashijitinfraprojects.com E: info@shashijitinfraprojects.com

STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2022 (Amount in Lakhs, except EPS Figure)

I			(Allie)	unit in Lakina, CAC	cpt Li o i iguie)
Sr. No.	Particulars	Quarter ended 31.12.2022	Corresponding Quarter ended 31.12.2021	Year to date ended 31.12.2022	Year ended 31.03.2022
01.	Total Income from Operations (net)	894.09	633.19	2538.63	2847.22
02.	Net Profit / (Loss) for the period	20.22	8.86	37.86	15.46
<u> </u>	(before Tax, Exceptional and/or Extraordinary items)				
03.	Net Profit / (Loss) for the period before tax	20.22	8.86	37.86	15.46
	(after Exceptional and/or Extraordinary items)				
04.	Net Profit / (Loss) for the period after tax	15.56	4.88	32.50	12.84
	(after Exceptional and/or Extraordinary items)				
05.	Total Comprehensive Income for the period	16.60	6.39	34.18	18.04
	[Comprising Profit / (Loss) for the period (after tax) and				
	Other Comprehensive Income (after tax)]				
06.	Equity Share Capital (Face value of Rs. 10/-)	1034.40	1034.40	1034.40	1034.40
07.	Reserves (excluding Revaluation Reserve) as shown in				99.12
	the Audited Balance Sheet of the previous year				
08.	Earnings Per Share (of Rs. 10/- each)				
	(for continuing and discontinued operations) -				
	1.Basic:	0.15	0.05	0.31	0.17
1	2.Diluted:	0.15	0.05	0.31	0.17

Note: The above is an extracts of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The said result has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their neeting held on 13th February, 2023. The full format of the Quarterly and Nine monthly Financial Results is available on the websites o the Stock Exchange. i.e. www.bseindia.com and on the Company's website www.shashijitinfraprojects.com.

> For and on behalf of the Board of SHASHIJIT INFRAPROJECTS LIMITED

Dated: 15th February, 2023 Place: Vapi

Ajit Jain **Chairman & Managing Director**

MAGELLANIC CLOUD LIMITED

CIN NO. L72100TG1981PLC169991 R.O.: 6th Floor, Dallas Center, 83/1, Plot No A1 Knowledge City, Rai Durg Rangareddi Hyderabad 500032, Telangana, INDIA WEBSITE: www.magellanic-cloud.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED 31st Dec., 2022

			Standalone	Result	
Sr.		Qi	uarter Ende	d	Year Ended
No.			30.09.2022 Unaudited	31.12.2021 Unaudited	31.03.2022 Audited
1.	Total Income from Operation (Net)	1,491.94	1,197.08	571.16	1,767.82
2.	Net Profit/(Loss) from Ordinary Activities After Tax	695.43	329.54	166.03	425.65
3.	Net Profit/(Loss) for The Period After Tax (After Extraordinary items)	695.43	329.54	166.03	425.65
4.	Equity Share Capital	2,808.63	2,808.63	2,516.69	2,516.69
5.	Earning Per Share (Before Extraordinary Items) (Of Rs.10/- Each) Basic:	1.70	1.10	0.48	1.08
	Diluted:	1.70	1.10	0.48	1.08
6.	Earning Per Share (After Extraordinary Items) (Of Rs.10/- Each)				
	Basic:	1.70	1.10	0.48	1.08
	Diluted:	1.70	1.10	0.48	1.08
Sr.	-		arter Ende	Year Ended	
No.	Particulars	31.12.2022 Unaudited	30.09.2022 Unaudited	31.12.2021 Unaudited	31.03.2022 Audited
		13.368.87	10.849.28	6,623.63	28,277.44
1.	Total Income from Operation (Net)	10,000.01	10,070.20		001505
2.	Total Income from Operation (Net) Net Profit/(Loss) from Ordinary Activities After Tax	1,735.43	2,866.16	393.38	2,945.85
	The same state of the same sta			393.38 2,516.69	2,945.85 2,516.69
2.	Net Profit/(Loss) from Ordinary Activities After Tax	1,735.43	2,866.16		
2. 3.	Net Profit/(Loss) from Ordinary Activities After Tax Equity Share Capital Earning Per Share (Before Extraordinary Items) (Of Rs.10/- Each)	1,735.43 2,808.63	2,866.16 2,808.63	2,516.69	2,516.69
2. 3.	Net Profit/(Loss) from Ordinary Activities After Tax Equity Share Capital Earning Per Share (Before Extraordinary Items) (Of Rs.10/- Each) Basic:	1,735.43 2,808.63 6.18	2,866.16 2,808.63 10.20	2,516.69 1.56	2,516.69 11.71

Place : Hyderabad Date : 14.02.2023

- The above statement of unaudited financial results were taken on record at the meeting of the Board of Directors held on 13th February, 2023.
- . The above is an extract of the detailed format of Quarterly Financial Result filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full Format of the Quarterly Financial Result are available on the Stock Exchange Websites: www.bseindia.com and Company Website: www.magellanic-cloud.com

By Order of the Board

Jagan Mohan Reddy Thumma (Managing Director)

NITIN CASTINGS LIMITED

CIN No. 165990MH1982PLC028822 Reg. Office: 202, A-Wing, Bldg. No. 3, Rahul Mittal Industrial Estate, Sir. M. V. Road, Andheri (East), Mumbai - 400 059

Un-Audited Financial Result for the Quarter and Nine Month Ended 31st December, 2022 ent of Un-Audited Financial Results for the Quarter and Nine Month Ended 31st De

Scrip Code: 508875				Rs. in	Lakhs (Except p	er share data
Particulars		Quarter Ended Nine Month Ended		Year Ended		
	31-Dec-2022	30-Sep-2022	31-Dec-2021	31-Dec-2022	31-Dec-2021	31-Mar-202
		Un-Audited		Un-Audited		Audited
Total Income from Operations	3,547.20	3,752.78	2,763.60	10,406.63	7,030.89	9,866.3
Net Profit for the period (before Tax, Exception and/or Extraordinary Items)	328.15	212.30	137.79	686.81	441.32	652.3
Net Profit for the period before Tax (after Exception and/or Extraordinary Items)	328.15	212.30	137.79	686.81	441.32	652.3
Net Profit for the period after Tax (after Exception and/or Extraordinary Items)	240.28	145.87	107.78	419.90	350.51	516.0
Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after Tax) and other comprehensives Income (after tax))	240.28	145.87	107.78	419.90	350.51	519.2
Equity Share Capital	257.07	257.07	257.07	257.07	257.07	257.0
Earning per Share (of Rs. 5/- each) Basic and Diluted (Note-1)	4.673	2.837	2.096	8.167	6.817	10.09

Date: 13th February, 2023

- (1) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 13th February, 2023.
- (2) The Company is engaged in manufacture of Alloys Steel Castings and there is no separate reportable segment as per Ind_AS 108.
- (3) The above financial results have been prepared in accordance with the section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India.
- (4) Figures of previous period have been regrouped and / or recasted wherever considered necessary to confirm the grouping o
- current period. (5) The Financial Results of the Company are submitted to BSE and are available on Company's website at www.nitincastings.com.
- (6) The figures of the last quarters are the balancing figures between the audited figures in respect of the full financial year and the
- unaudited published year to date figures upto the third quarter of the respective financial year. (7) The above is an extract of the details format of Quarterly Financial Results filed with the BSE under Regulation 33 of the SEBI (Listing

Obligation and Disclosure Requirement) Regulation, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of BSE and on the Company's website at www.nitincastings.com

For NITIN CASTINGS LIMITED Nipun Kedia

DIN No.: 02356010

CONTINENTAL CONTROLS LIMITED CIN No: L31909MH1995PLC086040

Gala No. 202, Krishna House, Shailesh Udyog Nagar, Opp. Nicholas Garage, Sativali Road,

Waliv, Vasai (East), Palghar - 401 208 | web site: www.continentalcontrols.net STATEMENT OF STANDALONE UNAUDITED RESULTS FOR THE QUARTER ENDED 31TH DEC. 2022

							Rs. in La
Sr.			Quarter ended		Half Yea	Year End	
No.	Particulars Particulars	31-Dec-22 (Unaudited)	30-Sep-22 (Unaudited)	31-Dec-21 (Unaudited)	31-Dec-22 (Unaudited)	31-Dec-21 (Unaudited)	31-Mar-2 (Audited
1	Revenue from operations	175.86	129.65	240.78	451.74	553.53	779.
Ш	Other income	3.07	0.39	2.99	6.63	3.79	132.
Ш	Total Income (I+II)	178.92	130.04	243.77	458.37	557.32	912.
I۷	Expenses						
	Cost of materials consumed	131.78	80.74	218.37	317.33	450.78	557.
	Changes in inventories of finished goods						
	and work-in-progress	0.14	(0.21)	(59.66)	(0.08)	(64.95)	6.
	Employee benefits expenses	11.09	13.26	14.25	34.09	43.18	57.
	Finance Cost	12.99	13.35	10.72	35.88	31.59	41.
	Depreciation and amortization expense	21.43	21.42	21.56	64.05	64.42	85
	Other expenses	45.00	55.46	65.33	144.05	145.36	199
	Total Expenses	222.43	184.02	270.57	595.31	670.38	947
٧	Profit before tax (III-IV)	(43.51)	(53.98)	(26.80)	(136.94)	(113.06)	(35.7
VI	Tax Expenses:						
	Income tax		8		*		
	Deferred tax	-	-	-			
	MAT credit utilised	-	=0	-			
	Profit for the period (V-VI)	(43.51)	(53.98)	(26.80)	(136.94)	(113.06)	(35.
	Other Comprehensive Income	-	-		-	-	
	Total Comprehensive income for the period	(43.51)	(53.98)	(26.80)	(136.94)	(113.06)	(35.7
	Total Pald-up Equity Share Capital (Face Value Rs. 10/- each)	614.63	614.63	614.63	614.63	614.63	614
	Reserves excluding Revaluation Reserves	-	-	-			
	Earnings Per Share (of Rs. 10/- each) (not annualized)						
	a. Basic	(0.71)	(0.88)	(0.44)	(2.23)	(1.84)	(0.
	b. Diluted	(0.71)	(0.88)	(0.44)	(2.23)	(1.84)	(0.

1 The above unaudited results have been reviewed by the Audit Committee and approved in the meeting of Board of Directors held or 14th February 2023 and Statutory Auditors of the Company have carried out Limited Review of the same

The Company's business activity falls within a single primary business segment.

iew of unaudited financial results for the quarter ended 31° Dec. 2022 as required in terms of clause 33 of the SEBI (LODR) regulations 2015 has been carried out by the statutory auditors.

Previous year's figures are re-grouped, re-arranged, re-classified wherever necessary.

For and on behalf of the Board of Directors Sd/-

Amit Thakkar

Director

Place : Mumbai Date : 14th February 2023

JAI CORP LIMITED

Read, Office: A-3, MIDC Industrial Area, Nanded - 431603, Maharashtra CIN: L17120MH1985PLC036500

Phone: (022) 6115 5300 • Website: www.jaicorpindia.com • e-mail for investors: cs2@jaicorpindia.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 315T DECEMBER, 2022

Standalone

(Rs. in Lakh except as stated) Consolidated

		otuliuulollo			OUIIGUIIGUIG		
Sr.	Particulars	Quarter	Nine Months	Quarter	Quarter	Nine Months	Quarter
No.	rai liculai s	Ended	Ended	Ended	Ended	Ended	Ended
		31.12.2022	31.12.2022	31.12.2021	31.12.2022	31.12.2022	31.12.2021
1	Total Income from Operations from Continuing Operations	13,018	47,155	17,748	13,489	48,686	18,344
2	Net Profit/(Loss) for the period/year (before Tax, Exceptional and/or Extraordinary items) from Continuing and Discontinuing Operations	1,561	5,235	1,720	1,146	3,966	1,522
3	Net Profit/(Loss) for the period/year before tax (after Exceptional and/or Extraordinary items/Associates) from Continuing and Discontinuing Operations	1,561	5,235	1,720	1,146	3,966	1,522
4	Net Profit/(Loss) for the period/year after tax (after Exceptional and/or Extraordinary items/Associates) from Continuing and Discontinuing Operations	1,157	3,854	1,246	832	2,551	1,077
5	Total Comprehensive Income for the period/year [Comprising Profit/(Loss) for the period/year (after tax) and Other Comprehensive Income (after tax)]	1,164	3,891	1,258	881	3,388	1,150
6	Equity Share Capital	1,785	1,785	1,785	1,785	1,785	1,785
7	Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations) - Basic & Diluted	0.65	2.16	0.70	0.47	1.43	0.60
8	Other Equity excluding Revaluation Reserve	-	-	-	-	-	-

a) The above is an extract of the detailed format of Quarterly and Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 read with SEBI circular 5th July, 2016. The full format of the Quarterly and Yearly Financial Results are available on the websites of the Stock Exchange(s) BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and the Company (www.jaicorpindia.com)

b) Qualified Opinion expressed by Independent Auditors on Consolidated Financial Results:

i) The consolidated financial results also include the Group's share of net profit/(Loss) after tax of Rs. (85) Lakh & Rs. (99) Lakh and total comprehensive income of Rs. (77) Lakh & Rs. (94) Lakh for the quarter and nine months ended 31st December, 2022 respectively, as considered in the unaudited consolidated financial results in respect of an associate, whose financial statements have not been reviewed by their auditor. Auditors of the Company have drawn qualification in their report in respect of said matter during the quarter and in earlier periods.

Further, during the quarter ended 30th September 2022 the Company received Audited Financial Statement of an Associate for the year ended 31st March 2022, according to which Group's share of loss after tax is Rs. 8 Lakh as against profit of Rs. 747 Lakhs considered for the year ended 31st March 2022 based on Certified Management accounts, consequently loss of Rs. 755 Lakh pertaining to 31st March, 2022 had been recognised in September 2022 quarter. ii) Interest accrued and due of Rs. 2147 Lakh on Inter company deposits, given by one of the subsidiaries of the Company in

earlier years, which are overdue for substantial period of time as the party has already paid Inter corporate deposits in earlier year pursuant to court order. The Subsidiary Company is pursuing recovery through a suit filed against the parties in the Hon'ble Bombay High Court. In view of the value of the assets of the parties and commitment from the Promoter of those parties, the Subsidiary Company is of the view that the entire outstanding amount is recoverable and no provision for doubtful advance is necessary.

iii) Inter company deposits of Rs. 1106 Lakh, given by one of the subsidiaries of the Company, which is overdue for substantial period of time and the Subsidiary Company has initiated legal proceedings against the party. In view of value of the assets of the party, the Subsidiary Company is of the view that the entire outstanding amount is recoverable and no provision for doubtful advances is necessary.

For and on Behalf of the Board

Gaurav Jain

Managing Director (DIN 00077770)

c) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 13° February, 2023. The Statutory Auditors of the Company have carried out a limited review of the above results.

Place: Mumbai Date: 13th February, 2023

ગુજરાત રાજ્ય

અન્ય સમાયારો

નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ <u>ટેન્ડર નોટિસ નં. ૧૭ સને ૨૦૨૨-૨૦૨૩.</u>

ગુજરાત રાજ્યના મા. રાજ્યપાલ શ્રી વતી થી કાર્યપાલક ઇજનેરશ્રી. દમણગંગા -નહેર વિશાખા વિભાગ નં.૩ બલિઠા (વાપી) ફ્રોન નં. ૦૨૬૦-૨૪૩૨૨૦૪ તરફથી રીપેરીંગ એચ.આર. ગેટ DRBMC. રેસ્ટોરેશન ઓફ અર્થવર્ક એન્ડ લાઇનીંગ, અને જંગલ કટિંગ નાં કૂલ મળીને ૯(નવ) કામ કે જેની અંદાજીત કિંમત ₹ ૧.૦૭ થી ૪.૮૨ લાખ સુધીનાં છે. આ કામો માટે ગુજરાત સરકારમાં માન્ય ઇજારદાર તરીકે નોંધાયેલ ઇ–ર વર્ગ અને તેની ઉપરના ઇંજારદારો પાસેથી બી-૧ ફોર્મમાં ભાવો મંગાવવામાં આવે છે. જરૂરી લગત દસ્તાવેજો તથા નિયત ટેન્ડર ફી રજુ કર્યેથી આ કામોના કોરા ટેન્ડર આપવાની છેલ્લી તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ ૧૬.૦૦ કલાક સુધી, તથા ભરેલ ભાવપત્રકો રજિસ્ટર પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ થી સ્વીકારવા ની છેલ્લી તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ ૧૨.૦૦ કલાક સુધી છે. શકય હશે તો આ ટેન્ડર તા.૨૮/૦૨/૨૩ ના રોજ ૧૬.૦૦ કલાકે ખોલવામાં આવશે. નોંધ:- ટેન્ડર સ્વીકરવાનો કે નકારવાનો હક્ક કાર્યપાલક ઇજનેરશ્રીની હસ્તક અબાધિત રહેશે. જેના માટે કોઇ કારણ આપવામાં આવશે નહીં.

નં.માહિતી/વલસાડ/૬૮૦/૨૩

જાહેર નોટીસ/સમન્સ

<u>નાયબ કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્ટેટ, વાંસદાની કોર્ટમાં</u> જન્મ મરણ નોંધણી અરજી નં. ૧૩/૨૦૨૩

દિનેશભાઇ નાનકાભાઇ આહિર રહે. વાડ ટેકરી ફળીયા, તા.ખેરગામ, જી.નવસારી વિરૂધ્ધ

તલાટી કેમ મંત્રીશ્રી સામાવાળા :-ગ્રામ પંચાયત કચેરી. વાડ તા.ખેરગામ, જી.નવસારી

આ કામના અરજદારશ્રી દિનેશભાઇ નાનકાભાઇ આહિર, રહે. વાડ, ટેકરી ફળીયા તા.ખેરગામ, જી.નવસારીએ તેઓનો માતા સ્વ. કમરીબેન નાનકાભાઇ આહિરનું મરણ મોજે. વાડ ટેકરી ફળીયા તા.ખેરગામ, જી.નવસારી મુકામે તા.૨૫/૦૪/૨૦૦૮નાં રોજ થયેલ હોવાનું જણાવી તેમના મરણની નોંધણી સામાવાળા સમક્ષ થયેલી નહી હોવાથી સામાવાળાને નોંધણી કરવા હુકમ મેળવવા બાબતે આધાર પુરાવા સહિત અત્રે અરજ ગુજારેલી છે. સબબ આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ/સમન્સથી જાણ ું કરવામાં આવે છે કે સદર કામે અરજદારની અરજી સામે કોઇના કોઇ પણ જાતના વાંધા વિરોધ અગર તકરાર હોય તો તે રજુ કરવા આ નોટીસની પ્રસિધ્ધિ થયાના ૩૦ (ત્રીસ) દિવસમાં કચેરી સમય દરમિયાન જાતે અથવા યોગ્ય રીતે માહિતગાર વકીલ મારફતે આધાર પુરાવા સાથે લેખિત રજુઆત સહિત હાજર થઇ રજુ કરવું. નિર્દિષ્ટ સમયમર્યાદામાં કોઇ વાંધા રજુ કરવામાં નહી આવશે તો અરજી સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.

તા.૦૮/૦૨/૨૦૨૩ સ્થળઃ વાંસદા



(ડી.આઇ.પટેલ) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ

કે.ટી.ઇટાલિયા (GAS) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર ની

<u>કોર્ટમાં</u>

અરજદાર ઃ- તારાબેન સંજયભાઇ ઢાઢર રહે. રાનવેરી, ડુંગરી ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડ.

વિરૂધ્ધ સામાવાળા ઃ- જન્મ મેરણ નોંધણી અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી, પીડવળ

જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩ (૩) અન્વયે જન્મની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ

હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી તારાબેન સંજયભાઇ ઢાઢર, રહે. રાનવેરી, ડુંગરી ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડનાઓએ તેમના પુત્રી શ્રેયાન્વીબેન સંજયભાઇ ઢાઢરનો જન્મ તા.૨૮/૦૪/૨૦૨૧ ના રોજ મોજે. પીંડવળ, તા.ધરમપુર મુકામે થયેલ છે. તેમના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચુકથી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોઇને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર પ્રાંત કચેરી ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઇસમોએ નોંધ લેવી.

આજ રોજ તા.૧૩/૨/૨૦૨૩ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નંએમએજી/જન્મ/૨જી નં.૧૨/૨૦૨૩ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ.

(કેતુલ ટી. ઇટાલિયા) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર

પાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પારડીની કોર્ટમાં, જ.મ.પ.અ.નં. ૩૫૬/૨૦૨૨

મલેકબેન બાબુભાઇ મેરાણી રહે. મોટા ઉચાલીયા, જાફરાબાદ, અમરેલી, ગુજરાત-૩૬૫૫૪૦,

(વ.શ્રી. મિલન આર. પટેલ) वि३ध्ध સામાવાળા


ચીફ ઓફીસરશ્રી નગર પાલીકા ઉમરગામ, તા.ઉમરગામ, જી.વલસાડ

<u> अन्य-भरण अधिनियम-१८६८ नी क्षम-१३ (३) अन्वये भरणनी नोंध कराववा</u> <u>માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ</u>

આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી મલેકબેન બાબુભાઇ મેરાણી, રહે. મોટા ઉચાલીયા, જાફરાબાદ, અમરેલી, ગુજરાત-૩૬૫૫૪૦નાએ તેમના માતા કુસુમબેન બાબુભાઇ રાશિયાણીનું મરણ તા.૦૫/૧૦/૨૦૧૩ ના રોજ મોજે-ઉમરગામ, તા.ઉમરગામ મુકામેં થયેલ છે. તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચુકથી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોઇને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી પારડી, પ્રાંત કચેરી પારડી, જી.વલસાડની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઇસમોએ નોંધ

લેવી આજ રોજ તા.૧૯/૧૨/૨૦૨૨ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નંએમએજી/મરણ/૨જી નં.૩૫૬/૨૦૨૨ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પારડીની કચેરી, તાલુકા સેવા સદન, બ્લોક નં.૨, પહેલો માળ, પારડી તા.પારડી, જી.વલસાડ.





શાકભાજી માર્કેટ, જ્યોતિ હોલ નીચે, વલસાડ ફોનઃ 241042

ડેરેસ ગળે



વરસાદ માં ગળતા ટેરેસ તથા દિવાલમાં થી આવતા ભેજને ક્રેક્ફીલીંગ કરી કેમીકલ્સ વળે વોટર પ્રુફીંગ કરી આપનાર

દરેક પ્રકારના મકાનો ને આકર્ષક કલર કામ કરી આપનાર



ઉમરગામની મહેતા કોલેજના વિદ્યાર્થીઓનું ઉત્કર્ષ પ્રદર્શન

(દ.ગં.ટા. પ્રતિનિધિ) ઉમરગામ, તા.૧૪ : નવાનિર્માણ કેળવણી મંડળ સંચાલિત સુરેશ મેહતાં કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ઉમરગામમા B.SC અને B. Com કોલેજના વિધાર્થીઓએ કિલ્લા પારડી ખાતે એન. કે દેસાઇ કોલેજમાં ઈન્ટર કોલેજ ULHAS

આવ્યું હતું. એમાં બોક્સ ક્રિકેટમાં સુજીત, જય, કૌશીક, સમર, ઉજજવલ, મોશીન, અંકીત ટીમ એ દ્વિતીય ક્રમે મેળવી અને લૂડો ગેમમાં ધોડીયા વિમલ દ્રિતીય ક્રમ મેળવી ક્રેમ્પસ અને કોલેજને ગૌરવ અપાવ્યું. એ માટે ક્રેમ્પસના સેક્રેટરી સુકેતુભાઈ મહેતા અને કોલેજના ઇ. આચાર્ય વૈષ્ણવી ગાવીત એ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં અભિનંદન પાઠવ્યા હતા.

પા.નં. ૧ નું ચાલુ.. પારડી હાઇવ.....

ચાલીમાં રૂમ નં .૭ તા.વાપી જી.વલસાડ મુળ રહે , ગામ -નવાશુકલતીર્થ જોગી ફળીયુ તા.જી.ભરૂચ, સુનિલ ઉર્ફે પોલુ મણીલાલ સલાટ ઉ.વ .૩૦ રહે, નવા ગેટની પાછળ, પપ્પુભાઇની વલસાડ જિલ્લા પોલીસે ૨૪

જગ્યામાં, ઝુપડપટ્ટીમાં તા.વાપી જી.વલસાડ મુળ રહે, ઉન પાટીયા, સુરત શહેર, કમલેશ મંગળભાઇ વાદી ઉ.વ .૨૬ રહે, બલીઠા, ફાટકપાસે, ઠાકોરભાઇની જગ્યામાં ઝુપડામાં તા.વાપી જી.વલસાડ મુળ રહે, ગામ - હેતમપુરા હાલ. બલીઠા, મેરીલ કંપનીના તા.જી.વડોદરા ની ધરપકડ કરતાં

જાહેર નોટીશ

આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, મારા અસીલ વોરવોકસ ડીજીટલ સોલ્યુશન એલએલપીની સુચના મુજબ મર્યાદિત જવાબદારી અધિનિયમ, ૨૦૦૮ ની કલમ ૧૩ ની પેટા કલમ- (૩) અને મર્યાદિત જુવાબદારી ભાગીદારી નિયમો, ૨૦૦૯ ના નિયમો ૧૭ મુજબ લિમિટેડ લાયબિલીટી પાર્ટનરશીપ એકટ, ૨૦૦૮ કલમ ૧૩(૩) હેઠળ વોરવોકસ ડીજીટલ સોલ્યુશન એલએલપી ની ફ્લેટ નં.૪૦૫, યોગી દર્શન-૨ જે બિલ્ડીગ, બાલાજી મંદિર પાસે, સેલવાસ, દાદરા નગર હવેલી ખાતે રજીસ્ટ્રર્ડ ઓફીસ આવેલ છે. સદર **વોરવોકસ ડીજીટલ સોલ્યુશન એલએલપી** જેઓ મર્યાદિત જવાબદારી અધિનિયમ, ૨૦૦૮ ની કલમ ૧૩ ની પેટા કલમ- (૩) હેઠળ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદને અરજી કરવાની દરખાસ્ત કરે છે અને તેની રજીસ્ટ્રર્ડ ઓફીસ ગુજરાત રાજ્ય આરઓસી - અમદાવાદ થી મહારાષ્ટ્ર રાજ્ય, આરઓસી- પૂર્ણમા સ્થાનાંતરિત થઇ ગઇ છે. જેથી એલએલપીની રજિસ્ટ્રર્ડ ઓફીસના સુચિત ફેરફારથી કોઇના પણ હિતને અસર થવાની સંભાવના હોય તે વ્યકતી તેના/તેણીના હિત અને આધારોની પ્રકૃતિ દર્શાવતી એફ્રીડેવીટ દ્રારા તેના વાંધાઓ રજિસ્ટૂર્ડ પોસ્ટથી મોકલી શકે છે.

સદર આ નોટીસના પ્રકાશનની તારીખથી ૨૧ (એકવીસ) દિવસની અંદર એલએલપીને તેની ઉપર જણાવેલ સરનામે તેની નોધાયેલ ઓફીસમા એક નકલ સાથે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, અમદાવાદને સોગંદનામા દ્રારા **વાંધાઓ રજૂ કરવા.** સદર મુદત વિત્યા બાદ કોઇના કોઇ પણ પ્રકારના દર દાવા, કે વાંધાઓ નથી અને જો તેવા હોય તો તે જતા કરેલા યાને વેવ કરેલા છે તેવુ સમજી લેવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવી.

મારી સુચનાથી, સહી/-

પંકજ એન. ભંડારી એડવોકેટ

વોરવોકસ ડીજીટલ સોલ્યુશન એલએલપી YOGESH SANJAY POPHALE (08875633) Designated Partner

DIVYA TEOTIA (09186302) Designated Partner

કે.ટી.ઇટાલિયા (GAS) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર ની

કોર્ટમાં.

અરજદાર ઃ- બેંડીબેન ગણેશભાઇ ધટકા

રહે. મોલવેરી, મુળગામ ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડ. વિરૂધ્ધ

ઃ- જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી, ગડી

<u>જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩ (૩) અન્વયે મરણની નોંધ</u> કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ

આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી બેંડીબેન ગણેશભાઇ ધટકા, રહે. મોલવેરી મુળગામ ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડનાઓ તેમના પતિ ગણેશભાઇ ઝીણાભાઇ ર્ધટકાનું મરણ તાઁ.૦૭/૦૬/૨૦૧૫ ના રોજ મોજે. મોલવેરી, તા.કપરાડા ખાતે મુકામે થયેલ છે. તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાર્થી અજાણ હોઇ ભુલ અને શરતચુકથી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોઇને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર, પ્રાંત કચેરી ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી

કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા.૧૪/૨/૨૦૨૩ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો

નંએમએજી/મરણ/રજી નં.૦૧/૨૦૨૩ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ. તા.98/૨/૨૦૨૩.

સહી/-(કેતુલ ટી. ઇટાલિયા) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર

કે.ટી.ઇટાલિયા (GAS) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર ની

કોર્ટમાં.

ઃ- મોહનભાઇ રડકાભાઇ સવરા રહે. ઝરીયા પારસી ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડ.

વિરૂધ્ધ

સામાવાળા ઃ- જન્મ મેરણ નોંધણી અધિકારીશ્રી અને

તલાટી કમ મંત્રીશ્રી, ઝરીયા

<u>જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩ (૩) અન્વયે જન્મની નોંધ</u> કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ

આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ કેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી મોહનભાઈ રડકાભાઇ સવરા, રહે. ઝરીયા પારસી ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડનાઓએ તેમના પુત્રી સુનીતાબેન મોહનભાઇ રડકાનો જન્મ તા.૧૬/૦૪/૧૯૯૦ ના રોજ મોજે. ઝરીયા, તા.ધરમપુર મુકામે થયેલ છે. તેમના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચુકથી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોઇને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર u્રાંત કચેરી ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધા રજુ કરવાના રહેશે. જો વાંધો ન^હી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઇસમોએ નોંધ લેવી.

આજ રોજ તા.૧૩/૨/૨૦૨૩ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને

નંએમએજી/જન્મ/રજી નં.૧૩/૨૦૨૩ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ.

સહી/-(કેતુલ ટી. ઇટાલિયા) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધરમપુર

દરેક બ્રાન્ડેડ કંપનીના શુટીંગ, શર્ટીંગ તથા લેટેસ્ટ કીઝાઇનમાં ટેલરીંગ શુટ સિવકાવો કાપક તથા સીલાઇ સાથે **ગ્રા.** 5000/



તા.૧૩/૨/૨૦૨૩.









વાંસદામાં બ્રહ્માકુમારી શિવરાત્રીનો મહોત્સવ ઉજવાશે

(દ.ગં.ટા. પ્રતિનિધિ) વાસદા, તા.૧૪: ૐ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ विधालय, वांसहा सेवाक्रेन्द्र द्वारा મહાશિવરાત્રીના પાવન પર્વને ૮૭ મી ત્રિમૂર્તિ શિવ જયંતીને શિવ અવતરણ થી સ્વર્ણિમ ભારત તરફ થીમના અંતર્ગત આખા ભારતમાં બ્રહ્માકુમારી દ્વારા

કલાકમાં લૂંટારુ ઓને મુદા માલ સાથે ઝડપી પાડી વધુ એક સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળવા

મનાવવામાં આવી રહી છે. ત્યારે

વાપી નજીકના બલીઠા વિસ્તારમાં રહેતા અને ગેસ કુકર રીપેરીંગનુ કામ કરતા વડોદરા બાજુના માણસો અંદરો અંદર પૈસા ભેગા કરી વીસી ચલાવતા હતા. જેમાં પકડાયેલ આરોપી સુનિલ ઉર્ફે પોલુ મણીલાલ સલાટનો પણ વીસીનો સભ્ય હોય જેથી દર મહીને કોને કેટલા પૈસાની વીસી લાગે તેની જાણ હોવાથી સુનિલ ઉર્ફે પોલુ નાએ તેના મિત્ર સુનિલ ઉર્ફે હરેશ રમેશભાઇ જોગી

પા.નં. ૮ નું ચાલુ.. સાદકપોર....

હતો જ્યારે બાજુમાં અર્ધબેભાન હાલતમાં અજય પણ પડેલ હતો જો કે આસાને ૧૦૮ સેવા મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલમાં લઈ આવતા ડોક્ટરે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું. જે બનાવ અંગેની જાણ મરનાર આશાની બહેન ધર્મિષ્ઠા એ

પશ્ચિમ રેલ્વે રીપેરીંગના કામો

डिविजनस रेस्वे मेने ४२ (उपस्युओ), ાડાવઝનલ રસ્ત મનજર (ડબસ્યુઅ), પશ્ચિમ રેલ્વે, છકો માળ, એન્જી. ડિપાર્ટમેન્ટ, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૮, નીચે પ્રમાણે આપેલી વિગતો મુજબ ઈ-ટેન્ડર મંગાવે છે. ટેન્ડર નોટીસ નંબર અને તારીખ: BCT/22-23/ 236 તા. ૧૩/૦૨/૨૦૨૩. કામ અને સ્થળ : જોરાવાસણ-સુરત સેક. - એસઆર. ડેન/સેન્ટ્રલ હેઠળ ૨ વર્ષ માટે રોજિંદા ધોરણે સમારકામની જરૂર છે. કામની અંદાજીત કિંમત ૧૪,૫૭૫,૯૯૫.૬૬/-. ઈએમડી : રૂા. ૨,૨૨,૯૦૦.૦૦, ભરવાની તારીખ અને સમય: ૧૪.૦૩.૨૦૨૩ ના ૧૫: ૦૦ કલાક સુધી. ખુલવાની તારીખ અને સમય તા. ૧૪.૦૩.૨૦૨૩ ના ૧૫ : ૩૦ **કલાકે.** વિગતવાર કામના પ્રકાર, ટેન્ડર દસ્તાવેજની ક્રિંમત ધરાવતા (નોન રિફ્રન્ડેબલ), ઈએમડી, લાયકાતના ધોરણો, સમાન પ્રકારના કામ, વિગતવાર ટેન્ડરની અંગે મહેરબાની કરીને www.ireps.gov.in ની મુલાકાત લો. મેન્યુઅલ ઓફરો સ્વીકારાશે નહીં.₀₈₃₉ અમને લાઈક કરો f facebook.com/WesternRly

<u>@home</u>

પા.નં. ૧ નું ચાલુ.... ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં એ કત્રિત થયા. ત્યાંથી ઉત્તર વન વિભાગ ફોરેસ્ટ

ઓફિસર સાહેબ શક્તિસિંહ સાધના દીદી, ભા.જ.પા. કિશાન મોરચા નવસારીના ઉપપ્રમુખ જીવસૃષ્ટિ તેમજ સંરક્ષિત વૃક્ષો ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય અને વિસ્તાર વિશે માહિતી ઉપસ્થિત ભાઈ-બહેનોના ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કર્યા નું શૈક્ષણિક ટ્રેકિંગ કરાવ્યું . બાદ શિવધ્વજ ફરકાવવામાં સાપની પ્રજાતિઓ અને આવ્યો ત્યારબાદ સૌને શિવભગવાનનો પરિચય આપી વિશેષતાઓ સમજાવવામાં પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. આવી. સૌ સારસ્વત મિત્રોએ પોતાના મનમાં આવતા પ્રશ્નો નાઓને ટીપ આપેલ અને બંનેએ કરી માહિતી મેળવી વર્ગખંડ ભેગા મળી પૈસા લુંટી લેવાનુ અને વિદ્યાર્થીઓ સુધી આ આયોજન કરી સુનિલ ઉર્ફે હરેશ માહિતી પહોંચાડવાની ખાતરી રમેશભાઇ જોગી તથા તેનો સાળો આપી. નાગલી ની રોટલી કમલેશ મંગળભાઇ વાદી નાઓએ ગુનો કરવા સારૂ તેઓના

વન્ય જીવ સૃષ્ટિ આપણાં જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ છે. ઉજ્જડ મેદાની પર્વતીય વિસ્તારમાં નાણાં પાંચ ની જોગવાઈઓ માં અગિયાર સાહેબ અને સ્રોક કેચર મિત્ર લાખ રોપાઓનું રોપાણ કરી નીરજ ભાઈ સંગાથે વન્ય બનાવેલ હરિયાળું વન સાક્ષાત જોવા મળ્યું અને સૌ એ માણ્યું. પર્યાવરણ નું જતન આપણાં આપતા આપતા ૪.૫૦ કિમી સૌની નૈતિક જવાબદારી અને કરજ છે. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરી વધ વૃક્ષારોપણ કરીએ, પ્રાણી પક્ષીઓનું સંવર્ધન અને રક્ષણ કરીએ. છોડ માં રણછોડ ની ભાવના સાકાર કરીએ. પાણીની બચત કરીએ. ગૌમાતા નું જતન કરીએ. સજીવ ખેતી કરીએ. આરોગ્યપ્રદ જીવન માણીએ. અને દેશી શાક સહ પૌષ્ટિક ભારત માતા અને વસુંધરા ની ભોજન આપવામાં આવ્યું હતું. જય જયકાર કરીએ.

<u>જાહેર નોટીસ</u>

સબ ડીવીઝનલ મેજીસ્ટેટશ્રી વલસાડની કોર્ટમાં. મં.વલસાડ નં એમએજી/જન્મમરણ/કેસ.નં. ૩૬૯/૨૦૨૨ અરજદાર ઃ- નાયકા ગંગાબેન ક્રિશનભાઇ.

રહે. ભગોદ, ડોરી ફળિયા, ગુજરાતી સ્કુલ પાસે, તા.જી.વલસાડ વિરૂધ્ધ

સામાવાળા ઃ તલાટોંકમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત ભગોદ

ઉપરોક્ત અરજદારશ્રીના દાદા સ્વ. બાલુભાઇ ઝીશાભાઇ નાયકાનું મરશ તા.૧૮/૦૬, ૧૯૯૬નાં રોજ મોજે ભગોદ. તા.જી.વલસાડ ખાતે થયેલ હોવા અંગેની મરણની નોંધણી કરવ અત્રેની કચેરીમાં અરજી કરેલ છે. જે વાસ્તે જે કોઇને અરજી વિરૂધ્ધ વાંધા હોય તેમણે દિન ૧૫ માં વાંધા અત્રેની કોર્ટમાં રજુ કરવા, વાંધા ન રજુ થયેથી અરજી મંજુર કરવામાં આવશે

નાય હતા. આજ તારીખ.૯/૨/૨૦૨૩ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો. સહી/-

(નિલેશ બી કુકડીયા) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ

SHASHIJIT INFRAPROJECTS LIMITED

CIN: L45201GJ2007PLC052114
Registered Office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Girnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India.

STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2022

, , , , , , , , , , , , , , , , , , , ,					
Sr. No.	Particulars	Quarter ended 31.12.2022	Corresponding Quarter ended 31.12.2021	Year to date ended 31.12.2022	Year ended 31.03.2022
01.	Total Income from Operations (net)	894.09	633.19	2538.63	2847.22
02.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	20.22	8.86	37.86	15.46
03.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	20.22	8.86	37.86	15.46
04.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	15.56	4.88	32.50	12.84
05.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	16.60	6.39	34.18	18.04
06.	Equity Share Capital (Face value of Rs. 10/-)	1034.40	1034.40	1034.40	1034.40
07.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				99.12
08.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1.Basic:	0.15	0.05	0.31	0.17
	2.Diluted:	0.15	0.05	0.31	0.17

The above is an extracts of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEB (LODR) Regulations, 2015. The said result has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at thei eeting held on 13th February, 2023. The full format of the Quarterly and Nine monthly Financial Results is available on the websites o the Stock Exchange. i.e. www.bseindia.com and on the Company's website www.shashijitinfraprojects.com.

Dated: 15th February, 2023 Place: Vapi

9,862.24

94.50

ઓળખીતા મુજજમીલ ઉર્ફે મુજજુ

૫/૦ ઇમ્તીયાઝ ઇબ્રાહિમ ખલીફા

તથા નહી પકડાયેલ આરોપી

સાહીદ શેખ નાઓને ટીપ કર્યો

હતો. અને ત્યારબાદ તમામે ભેગા

મળી આયોજન કરી ગુનો આચરી

ફરીયાદી તથા તેમની માતા ને

પોલીસ તરીકેની ખોટી ઓળખ

આપી પૈસા પડાવીભાગી ગયા

ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ

કરતા બનાવની વધુ તપાસ ચીખલી

પોલીસ મથકના પીએસઆઇ

કડીવાલાએ હાથ ધરી છે.

For and on behalf of the Board of SHASHIJIT INFRAPROJECTS LIMITED

Chairman & Managing Director

નિલકમલ લિમિટેડ

૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના અંતે પૂરા થતા ત્રિમાસિક અને નવ મહિનાના અનઓડીટેડ નાણાકીય પરિણામો

CIN: L25209DN1985PLC000162 **૨૪ ઓફીસ:** સર્વે નં. ૩૫૪/૨ અને ૩૫૪/૩. ૨ાખોલી બ્રીજ પાસે सिट्वासा - जानवेल रोड, वसोना गाम, सिट्वासा - उट्ह्२३० (हा अने न.ह.) વેબસાઈટ: www.nilkamal.com • ઈ-મેલ: investor@nilkamal.com

Nilkamal

(₹ લાખમાં)

9,862.24

46.86

એકીકૃત સ્ટેન્ડલોન નવ મહિના સમયગાળો ૩૧/૧૨/૨૦૨૨ ચાલુ ત્રિમાસિક ત વર્ષના ત્રિમાસિ ચાલુ ત્રિમાસિક ગત વર્ષના ત્રિમાસિ સમયગાળો ૩૧/૧૨/૨૦૨૨ વિગત સમયગાળો ૩૧/૧૨/૨૦૨૨ અંત સમયગાળો ૩૧/૧૨/૨૦૨૧ અત સમયગાળ 3૧/૧૨/૨૦૨૧ સમયગાળો ૩૧/૧૨/૨૦૨૨ અન્ઓડીટેડ અન્ઓડીટેડ અન્ઓડીટેડ અન્ઓડીટેડ અન્ઓડીટેડ અન્ઓડીટેડ 2.30,966,80 ₹€,3₹४.3₹ 50,232.60 2,94,692.62 64,856.50 64,580.09 ૨ કરવેરા પૂર્વે ચોખ્ખો નફો, અપવાદરૂપ 3,064.0 3,969.67 e,489.46 8,000.00 8,986.40 90,526.95 આઈટમ અને અસાદારણ આઈટમો પૂર્વ કરવેરા પૂર્વે ચોખ્ખો નફો, અપવાદરૂપ 8,0€6.20 ۹٥,६८७.٩६ આઈટમ અને અસાધારણ આઈટમો પછી કરવેરા પછીનો ચોખ્ખો નફો, અપવાદરૂપ **७,**9∈9.30 ८,4७4.७८ આઈટમ અને અસાધારણ આઈટમો પછી સમય માટે કુલ વ્યાપક આવક વ્યાપક નકો ₹,354.34 2,362.90 ७,२२६.93 3,365,42 3,320.46 2,402.86 (કરવેરા પછી) અને અન્ય વ્યાપક આવક

બેઝિક અને ડાઈલ્યુટેડ (વાર્ષિક નથી) (₹)

(કરવેરા પછી)

ઈક્વિટી શેર મૂડી

(શેર દીઠ ₹ ૧૦ ની ફેસ વેલ્યુ)

શેર દીઠ આવક (શેર દીઠ ₹ ૧૦ ની ફેસ વેલ્યુ)

(૧) ઉપરોકત પરિણામો સંક્ષિપ્તમાં આપેલ છે. તેબી નિયમન ૩૩ મુજબ (લીસ્ટીગં ઓબ્લીગેશન એન્ડ ડીસકલોઝર રીકવાયરમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ના જોગવાઈ મુજબ કંપનીના વિગતવાર પરિણામો સ્ટોક એક્ચેન્જમાં આપેલ છે. કંપનીની નાણાંકીય પરિણામો સ્ટોક એક્ચેન્જની વેબસાઈટ (www.bseindia.com) અને (www.nseindia.com) તથા કંપનીની વેબસાઈટ (www.nilkamal.com) ઉપર ઉપલબ્ધ છે.

9,862.24

94.66

9,862.24

8C.96

9,862.21

55.55

બોર્ડના આદેશ દ્વારા **निसक्त्रमस सिमिटेऽ** वती 권**6**]/-હિતેન વી. પારેખ

ਮੌਕੇਲਾਂગ ડਿਵੇકਟਵ

9,862.24

55.36

સ્થળઃ મુંબઇ તારીખઃ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૩



Jai Jalaram Bapa **Septic Tank Cleaner** ખાળ કુવાની સફાઈ खार कुंवे की सफाई

TANKER CAPACITY 8000 LITER WATER JETTING, AIR BLOWING, VACUUMING

પાણીના પ્રેશરથી હવા મારીને ટાંકી સાફ કરી આપવામાં આવશે. આધુનીક મશિનરી થી કામ કરી આપવામાં આવશે.

Contact: 99046 44348, 98247 28200